

19 એપ્રિલ 2025 થી લાગુ

પર્સનલ લોન માટેના શુલ્કની સૂચિ

ક્રમ નં.	પરિમાણો	વાસ્તવિક શુલ્ક (GST સિવાય)
1	વ્યાજદર	વાર્ષિક 10.49% થી વાર્ષિક 15%
2	લોનની પ્રક્રિયા માટેનો શુલ્ક	લોનની રકમના 3% સુધી (વિતરણ રકમમાંથી બાદ કરવામાં આવશે)
3	લોન રદ કરવા માટેનો કુલિંગ પીરિયડ	લોન વિતરણની તારીખથી 5 દિવસ (કુલિંગ પીરિયડ દરમિયાન રદ કરાયેલી લોન માટે કોઈ દંડ વસૂલવામાં આવશે નહીં)
4	સ્ટેમ્પિંગ શુલ્ક	તમિલનાડુ રાજ્યના સ્ટેમ્પ એક્ટ મુજબ
5	બાકી ચુકવણી પરનું વ્યાજ	ચુકવણીની નિયત તારીખથી વાસ્તવિક તારીખ સુધી ચુકવણીની બાકી રકમ પર દર મહિને 3%
6	ફોરક્લોઝર/પૂર્વચુકવણી શુલ્ક	ગ્રાહક દ્વારા 12 EMI ની ચુકવણી કર્યા બાદ લોનના ફોરક્લોઝર/પૂર્વચુકવણી માટે મંજૂરી આપવામાં આવશે. બંધ કર્યાની તારીખે બાકી રહેલી મુદ્દલ પર 2%
7	આંશિક પૂર્વચુકવણી	6 EMI ની ચુકવણી કર્યા બાદ આંશિક પૂર્વચુકવણી માટે મંજૂરી આપવામાં આવે છે. 6 EMI અથવા બાકી રહેલી મુદ્દલના 10%, જે વધારે હોય તે ન્યૂનતમ આંશિક ચુકવણી ગ્રાહક ચૂકવી શકે છે. ગ્રાહક દ્વારા પૂર્વચુકવણી કરવામાં આવેલી રકમ પર 2%.
8	EMI રિટર્ન (ચેક/SI/ACH/ECS) શુલ્ક	પ્રત્યેક બનાવ પર ₹ 500
9	ક્રેડિટ લાઇફ ઇન્શ્યોરન્સ	ક્રેડિટ લાઇફ ઇન્શ્યોરન્સ લઈ રહેલા ગ્રાહકો માટે વીમા કંપનીના નિયમો અને શરતો લાગુ પડશે.
10	ચુકવણીનો પ્રાથમિકતા ક્રમ	જો એક જ ગ્રાહકને બે કે તેથી વધુ લોન આપવામાં આવે છે તો, ચુકવણીના પ્રાથમિકતા ક્રમમાં અસુરક્ષિત લોનને પ્રાથમિકતા મળશે.

નોંધ:

1. પ્રત્યેક સંબંધિત પર્સનલ લોન પ્રોડક્ટ વિકલ્પો માટે ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક દ્વારા નક્કી કર્યા મુજબ શુલ્ક લાગુ પડે છે.

2. ફી અને શુલ્ક ઉપરાંત પ્રવર્તમાન દર મુજબ લાગુ પડતા GST અને અન્ય સરકારી કર વસૂલવામાં આવશે.